

ઓરીસ્સા ગંજામ જીલ્લાના શેરગઢ પો.સ્ટે. વિસ્તારના ખુન તથા ખુનની કોશીષના ગુનામાં  
નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ

ઓરીસ્સા રાજ્યના ગંજામ જીલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશનમાં ખુન તથા ખુનની કોશીષના ગુનાનો વોન્ટેડ આરોપી છોટા ઉર્ફે બલરામ સ્વાંઈ સુરત શહેરમાં છુપાયેલ હોવાની હકીકત આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ મજકુર આરોપીને ઝડપી પાડવા વર્કઆઉટ શરૂ કરેલ હતું. દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી છોટા ઉર્ફે બલરામ સૌરા સ્વાઈ ઉ.વ-૨૬ રહે-સરદાર શાકભાજી માર્કેટ પાસે આવેલ કુટ માર્કેટના કુટપાથ ઉપર સુરત મુળ ગામ-ગોવિંદપુરગામ પો.સ્ટે-શેરગઢ, જી-ગંજામ (ઓરીસ્સા) વાળાને ક્રાઈમ બ્રાંચની ટીમે સહારા દરવાજા-કડોદરા હાઈવે ઉપર આવેલ કુટ માર્કેટ પાસેથી ઝડપી પાડી આરોપીનો કબ્જો ઓરીસ્સા પોલીસને સોંપેલ છે.

મજકુર આરોપીની પુછપરછમાં તેના વતનમાં તેનો મિત્ર મિટ્ટુ ઉર્ફે નાથીયો સ્વાંઈ નાઓનો દેશી દારૂની સરકાર માન્ય શોપ ચલાવતો હતો અને તે જ ગામમાં મરણ જનાર કિષ્ણા વિશ્વનાથ સ્વાંઈ પણ દેશી દારૂની દુકાન ચલાવતો હોય તે બંને વચ્ચે ધંધાકીય હરીફાઈને લઈને અવાર નવાર ઝઘડા ચાલી આવેલ હોય જેથી સને ૨૦૧૭ ના સપ્ટેમ્બર માસમાં આરોપીએ તેના મિત્ર મિટ્ટુ ઉર્ફે નાથીયો સ્વાંઈ તેમજ અન્ય સાગરીતો સાથે ભેગા મળી કિષ્ણા સ્વાંઈ ઉપર તલવાર તથા ધારીયા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરેલ જેમા કિષ્ણા સ્વાંઈ બચી જતા મજકુર આરોપીઓએ આ કિષ્ણા સ્વાંઈ ઉપર ફરીથી બીજીવાર તા.૦૭/૦૪/૨૦૧૮ ના રોજ તલવાર, ધારીયા વગેરેથી જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવી સુરત ખાતે નાસી આવી પોતાની ઓળખ છુપાવી રહેતો હોવાની હકીકત જણાવેલ છે. મજકુર આરોપી શેરગઢ પો.સ્ટે.ના નીચે મુજબના ગુનામાં વોન્ટેડ છે.

(૧) શેરગઢ પો.સ્ટે. ૬૭/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૦૭,૩૨૬,૩૨૫,૩૨૪,૩૪૧,૩૨૩,૩૪

(૨) શેરગઢ પો.સ્ટે. ૩૨/૨૦૧૮ ઈ.પી.કો.કલમ ૩૦૨, ૩૪ તેમજ અગાઉ તે ખુનની કોશીષ, ઘાડ, લુંટ જેવા ચાર ગુનાઓમાં પકડાઈ ચુકેલ હોય સ્થાનિક કોર્ટમાં તેના વિરૂધ્ધ ચાલી રહેલ કેસોમાં પણ તે હાજર ન રહેતો હોય કોર્ટ દ્વારા તેના વિરૂધ્ધ એરેસ્ટ વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવેલ છે.

સદરહુ કામગીરી સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આરોપી પકડી પાડી પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ છે.